

RAN-2408000602030001
F.Y.B.Com. (Semester-II) Examination March - 2026
Economics : Minor Managerial Economics
સંચાલકીય અર્થશાસ્ત્ર
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: Student's Signature
--	--

- પ્ર-1. ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) 10**
- 1) પેઢીની સમતુલા એટલે શું? પેઢીની સમતુલાની શરતો જણાવો.
 - 2) વેચાણ ખર્ચનો અર્થ આપો.
 - 3) મૂડી અંદાજપત્ર એટલે શું?
 - 4) વેતન એટલે શું?
 - 5) ઈજારો એટલે શું?
 - 6) અલ્પહસ્તક ઈજારાના લક્ષણો જણાવો.
 - 7) નફાનો અર્થ આપો.
- પ્ર-2. પૂર્ણ હરિકાઈમાં પેઢીની ટૂંકાગાળાની અને લાંબાગાળાની સમતુલા આકૃતિસહિત સમજાવો. 14**
- અથવા**
- પ્ર-2. અ) ઈજારાયુક્ત હરિકાઈમાં પેઢીની ટૂંકાગાળાની સમતુલા આકૃતિસહિત સમજાવો. 07**
- બ) કિંમત નેતૃત્વની વિસ્તૃત ચર્ચા કરો. 07**
- પ્ર-3. મૂડીરોકાણના માપદંડ તરીકે પરત ચૂકવણી સમયગાળો અને ચોખ્ખી વર્તમાન મૂલ્ય પદ્ધતિ સમજાવો. 14**
- અથવા**
- પ્ર-3. અ) વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબળોની ચર્ચા કરો. 07**
- બ) પ્રો. શુમ્પીટરનો નફાનો સિદ્ધાંત સમજાવો. 07**
- પ્ર-4. ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે) 12**
- 1) કિંમત ભેદભાવના પ્રકારો.
 - 2) ખાંચવાળી માંગરેખા.
 - 3) મૂડી અંદાજપત્રનું મહત્વ.
 - 4) નફાનો ગતિશીલ સિદ્ધાંત.

ENGLISH VERSION

Q-1.	Answer in short. (Any five)	10
1)	What is equilibrium of a firm? State the conditions of equilibrium of a firm.	
2)	Give the meaning of selling cost.	
3)	What is capital budgeting?	
4)	What is wages?	
5)	What is monopoly?	
6)	State the characteristics of oligopoly.	
7)	Give the meaning of profit.	
Q-2.	Explain the short run and long run equilibrium of a firm under the perfect competition with the help of diagram.	14
	OR	
Q-2.	A) Explain the short run equilibrium of a firm under the monopolistic competition with the help of diagram.	07
	B) Discuss the price leadership in detail.	07
Q-3.	Explain the pay-back period and the net present value methods of evaluation of capital investments.	14
	OR	
Q-3.	A) Discuss the factors affecting real wages.	07
	B) Explain the Prof. Schumpeter's theory of profit.	07
Q-4.	Write short notes. (Any two)	12
1)	Types of price discrimination.	
2)	Kinked demand curve.	
3)	Importance of capital budgeting.	
4)	Dynamic theory of profit.	